



ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જુનાગઢ

(ગુજરાત અધિનિયમ નં. ૨૩/૨૦૧૫ દ્વારા સ્થાપિત)

BHAKTA KAVI NARSINH MEHTA UNIVERSITY, JUNAGADH

[Established vide Government of Gujarat Act No. 23/2015]

તા. ૧૭/૦૭/૨૦૨૧

વિષય : પ્રથમ પદવીદાન સમારોહમાં ઓનલાઈન માધ્યમથી જોડાવા અંગેનું નિમંત્રણ પાઠવવા બાબત.

સવિનય, આપ સુવિદિત છે કે આ યુનિવર્સિટીની સ્થાપના થયા બાદ તેનો પ્રથમ પદવીદાન સમારંભ યોજવા અંગે આપણા સૌના પ્રયત્નો ચાલુ હતા પરંતુ છેલ્લા દોઢેક વર્ષથી કોરોના મહામારીના કારણે આ પદવીદાન સમારંભ યોજી શકાયેલ ન હતો અને ત્યારબાદ પણ સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ કેટલીક સૂચનાઓને કારણે આ આયોજનમાં વિલંબ થતો હતો પરંતુ મને જણાવતાં અતિ ગર્વ અને આનંદ થાય છે કે આ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારંભ આપણે જૂનાગઢ ખાતે તા.૨૧-૦૭-૨૦૨૧ ના રોજ સવારના ૧૧:૦૦ કલાકે કૃષિ યુનિવર્સિટીના ઓડીટોરીયમમાં માનનીય મુખ્યમંત્રીશ્રીની અધ્યક્ષતામાં યોજશે. આ સમારંભમાં માનનીય શિક્ષણમંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ યુડાસમા, માનનીય પ્રવાસન અને મત્સ્યોદ્યોગ મંત્રીશ્રી જવાહરભાઈ ચાવડા, રાજ્યકક્ષાના માનનીય શિક્ષણમંત્રી સુ.શ્રી.વિભાવરીબેન દવે અતિથી વિશેષ તરીકે હાજરી આપશે જેમાં પદવી ધારણ કરનાર સર્વ વિદ્યાર્થીઓને આદરણીય પૂ.ભાઈશ્રી રમેશભાઈ ઓઝા, પોરબંદર ખાસ ઉપસ્થિત રહી તેમની દિવ્યવાણી દ્વારા આશીર્વાચનો વિદ્યાર્થી સમુદાયને આપશે.

આ કાર્યક્રમમાં યુનિવર્સિટી સલંગન આપ સૌ સંચાલકશ્રીઓ, કોલેજના આચાર્યશ્રીઓ અને અધ્યાપકશ્રીઓ આ ઐતિહાસિક પ્રથમ પદવીદાન સમારંભમાં જોડાઈ અને કાર્યક્રમની ગરિમા જળવાય તેવું માન.કુલપતિશ્રી પણ ઈચ્છી રહ્યા છે. પરંતુ તાજેતરમાં કોવીડ-૧૯ના સંક્રમણને અટકાવવા તકેદારીના ભાગરૂપે રાજ્ય સરકારશ્રી દ્વારા બહાર પાડવામાં આવેલ કેટલીક માર્ગદર્શિકા તથા મર્યાદાઓને કારણે આપ સર્વ શિક્ષણવિદશ્રીઓને ઉપરોક્ત પદવીદાન સમારંભમાં ઓનલાઈન માધ્યમથી નીચે દર્શાવેલ લીંક મારફત અચૂક જોડાવવા અને આપની કોલેજના વધુમાં વધુ વિદ્યાર્થીઓ આ પદવીદાન કાર્યક્રમમાં સાક્ષી બને તેવી વિનંતી કરું છું.

આશા છે કે આ યુનિવર્સિટીના ભવ્ય પદવીદાન સમારોહમાં ઓનલાઈન માધ્યમથી આપ સૌ વિદ્યાર્થીઓ સાથે જોડાઈ પદવી મેળવનાર વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરશો.

કાર્યક્રમની લીંક



Facebook: www.facebook.com/bknmujunagadh



YouTube channel: [Bhakta Kavi Narsinh Mehta University Junagadh](https://www.youtube.com/BhaktaKaviNarsinhMehtaUniversityJunagadh)

કા.કુલસચિવ

સરકારી પોલીટેકનીક કેમ્પસ,
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી રોડ,
ખડીયા, જુનાગઢ-૩૬૨ ૨૬૩, ગુજરાત(ભારત)
ફોન નં.૦૨૮૫-૨૬૮૧૪૦૦ / ફેક્સ નં.૦૨૮૫-૨૬૮૧૫૦૩

Government Polytechnic Campus
Bhakta Kavi Narsinh Mehta University Road
Khadiya, Junagadh-362263 (Gujarat)
Ph: 0285-2681400 fax: 0285-2681503

Web: <http://www.bknmu.edu.in> || **Email:** info@bknmu.edu.in